



પ્રેઝન્ટર

હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું 'take a back seat' એટલે 'પાછળની સીટ લેવાં' વિશે.

અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં 'take a back seat' વિશે તમે કેટલું જાણો છો. ડોન્ટ વરી...હું તમને સમજાવું.

રોબ અને ફેફેઈને કંઈક કરી રહ્યા છે. મિત્રો, શું તમને ખબર બન્ને ક્યાં છે? રોબ અને ફેફેઈ માંથી કોન વધારે કામ કરી રહ્યું છે? શા માટે રોબ શાંતિથી બેઠો છે? ચાલો જાણીએ..

Rob

Feifei, keep your eyes on the road! Look where you're going.

Feifei

OK, OK! Rob is making me drive around while we present today's programme. Rob, why *exactly* am I driving my car?

Rob

Well, I really wanted you to understand the phrase we're going to learn today. But I'm going to leave it all to you.

પ્રેઝન્ટર

તો ફેન્સ, બન્ને ફેફેઈના કારમાં છે. ફેફેઈ કાર ચલાવી રહી છે અને રોબે બધી વસ્તુ ફેફેઈ ઉપર છોડી દીધી છે જેને અંગ્રેજીમાં કહીશું 'leave it all to her.'

Feifei

So what are you going to do then?

Rob

Oh nothing. I'm just going to take a back seat today. You carry on, I'll just watch.

Feifei

Take a back seat? Hmmm – so you're going to let me take control – do all the work – while you sit there and watch?

Rob

Yes – look, I'm just sitting here – on the back seat.

Feifei

Oh I get it! 'To take a back seat' is an idiom that means to give up control and let someone else take responsibility.

Rob

That's it Feifei.

પ્રેઝન્ટર

રોબ ફેફેઈને જણાવે છે એને કારમાં પાછળની સીટ લઈ રહ્યો છે જેને અંગ્રેજીમાં કહીશું 'taking a back seat.' અંગ્રેજીમાં આ અભિવ્યક્તિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તમે ઇચ્છો છો કે બીજી વ્યક્તિ જવાબદારી લે અને સંચાલન કરે. સામેની વ્યક્તિ પોતાને સશક્ત ગણે એટલા માટે 'taking a back seat' અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કારમાં 'back seat' એટલે પાછળની સીટમાં બેસવું અને બીજા વ્યક્તિને કાર ચલાવવા દેવી.

મિત્રો, આ અભિવ્યક્તિ દરેક વખત કાર ચલાવવા સાથે સંલગ્ન નથી. યાદ રાખો કે આ અભિવ્યક્તિ એકવચન છે. આ અભિવ્યક્તિ 'a' અને ક્રિયાપદ 'take' સાથે ઉપયોગમાં લેવામાં આવે છે.

હજુ કનફ્યુઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ.

Examples

Mary was happy to take a back seat and let Jim run the meeting. It was his turn to be responsible for the team's decision.

Honey, I'm going to take a back seat this year and let you decide where we go on holiday. I always choose and I want you to be more involved in our decisions.

Now he's getting older he's decided to take a back seat in running the company and has handed things over to his son.

Feifei

So, to take a backseat means to choose not to take control and let someone else be in charge. Rob, does this mean you're just being lazy?

Rob

Of course not, Feifei. It just means I'm letting you have a turn at being in charge – I trust you – although... What are you doing?!

Feifei

Letting you take the back seat while I show you how to really drive!

Rob

Feifei! Watch out for that roundabout... and that traffic light... aren't you driving a bit fast?

Feifei

Rob – don't be such a back seat driver!

Rob

A what?

Feifei

A back seat driver – someone who offers unwanted advice – someone who tells the driver how to drive. But we'll leave that expression for another day!

Rob

OK, OK – but you are going really fast – can I take the front seat now?

Feifei

Stay where you are!

પ્રેઝન્ટર

લાગે છે કે રોબ 'taking a back seat' થી ખુશ નથી અને ફેફેઈને સંચાલન આપવા રાજી નથી. પણ ફેફેઈ 'take a back seat' માટે રાજી નથી.

તમારા વિશે જણાવો મિત્રો? શું તમે ક્યારેય 'taking a back seat' જેવો અભિગમ અપનાવશો કે પછી તમે સમગ્ર પરિસ્થિતિ ઉપર પોતાનો કાબુ રહે એવું ઇચ્છશો? શું તમે એવી કોઈ પરિસ્થિતિનો સામનો કર્યો છે જેમાં 'take a back seat' જરૂરી હતું. આમ કરવાથી તમને કોઈ સમસ્યાનો સામનો કરવા પડ્યો હતો?

આવા જ બીજા રસપ્રદ ટોપિક્ સાથે ફરીથી મળીશું English Expressions માં...ત્યાં સુધી Bye!